

RAJATH FINANCE LIMITED

CIN: L65910GJ1984PLC007486

Regd. Office: 208-2015, Star Plaza, Phulchhab Chowk, Rajkot - 360001, Gujarat

E-mail: rajathfin@hotmail.com Contact: 0281 3013344 / 2447800

Website: www.rajathfinance.in

03 January, 2024

To,
The Department of Corporate Services,
The BSE Ltd., 1st Floor,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai - 400 001,
Maharashtra, India

Script Code No: 507962

Sub: Newspaper Publication of Notice of Extra-ordinary General Meeting to be held on 25th January, 2024.

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, We submit herewith the newspaper advertisement of the Notice of Extra-ordinary General Meeting of Rajath Finance Limited ("**Company**") to be held on Thursday, 25th Day of January, 2024 in Economic Times and Navgujarat Samay on 03rd day of January, 2024.

Please take the same on your records.

Yours faithfully,
Rajath Finance Limited

Akash Hiren



Aakash Hirenbai Bheda
Company Secretary & Compliance Officer

Truckers' Strike Triggers Panic

Protests by truckers' associations in several states against stricter punishment in the new law on hit-and-run cases enter Day 2, impacting the supply of some essentials and leading to panic buying of fuel in many cities

Fruit & Veggies Set to Get Expensive as Supplies Hit

Shambhavi Anand

New Delhi: Prices of fresh vegetables and fruits are expected to shoot up in the National Capital Region as supply has almost halved due to the transporters' strike, said traders from Azadpur Mandi, the largest wholesale market for vegetables and fruits, and Ghaziabad.

While the price of onions has increased Rs 8 per kg to Rs 46 on average, the number of trucks bringing in potatoes has fallen to 50 from 115, said Rajendra Shukla, a vegetable and fruit trader from Ghaziabad.

The supply of fruits such as bananas and apples has also dwindled, pushing up prices 5-10% in the wholesale market, said traders.

It comes as truckers and bus operators went on a three-day nationwide strike from Monday opposing the Rs 7 lakh penalty and 10-year jail term for hit-and-run cases under the new law. The Samajwadi Party, urging the central government to withdraw the provision as they argued it could lead to undue harassment.

Prices of other vegetables such as okra, cauliflower and brinjal have also increased, said traders.

Anil Kumar, a vegetable trader from Ghaziabad Mandi, said if the strike is not called off, the prices of fresh fruits and vegetables will increase further. "Delhi gets its supply of fruits and vegetables from various states. If trucks don't operate, there is no other way to get that supply," he said.

The strike has hit the supply of



(Top) People queue up at a petrol pump in Mumbai as strike cripples fuel supply in the city; a clash took place between striking truck drivers and police personnel in UP's Maiharipur; photos: BCC & ANI

fresh fruits, vegetables as well as fuel across states, including Maharashtra, Madhya Pradesh, Gujarat,

and Punjab, according to traders.

shambhavi.anand@timesgroup.com

Coal India's Supply to Non-Regulated Sector Rises 31%

New Delhi: State-owned Coal India Ltd (CIL) on Tuesday said its supplies to the non-regulated sector rose 31% to 98 million tonnes (mt) in the April-December period of the current fiscal year, up from 75 mt in the corresponding period of the previous financial year.

"Even as CIL supplies to the country's power sector exceeded the projected commitment, the company supplied an all-time high volume of 96 million tonnes to non-regulated sector commences till December," the maharashtra said in a statement.

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

Mechanism to Monitor Steel, Aluminium Products Export at Concessional Rates to US Soon

New Delhi: Ministries of mines, steel and the department for promotion of industry and foreign trade (DPIIT) will soon come up with a mechanism to monitor the export of steel and aluminium products at concessional rates to the US, an official said. Indian exports of these products were earlier attracting additional duties in the US, as Washington, in 2018,

imposed a 25 per cent import duty on steel products and 10 per cent on certain aluminium products and grades of steel and aluminium. In response, India, in June 2018, imposed additional customs duties on 28 American products.

The US is now allowing the Indian partners to export 25 per cent and 10 per cent duties in return for New Delhi's decision to remove retaliatory duties on eight American products like apple and walnut.

The official also said that the two countries have agreed to set up a joint monitoring mechanism to enable domestic exports to America of at least 30 lakh tonnes of cement and steel and aluminium products in a year without paying duties.

In a statement, the official said, Indian exports of these products were earlier attracting additional duties in the US, as Washington, in 2018, imposed a 25 per cent import duty on steel products and 10 per cent on certain aluminium products and grades of steel and aluminium. In response, India, in June 2018, imposed additional customs duties on 28 American products. The US is now allowing the Indian partners to export 25 per cent and 10 per cent duties in return for New Delhi's decision to remove retaliatory duties on eight American products like apple and walnut.

The official also said that the two countries have agreed to set up a joint monitoring mechanism to enable domestic exports to America of at least 30 lakh tonnes of cement and steel and aluminium products in a year without paying duties.

The official also said that the two countries have agreed to set up a joint monitoring mechanism to enable domestic exports to America of at least 30 lakh tonnes of cement and steel and aluminium products in a year without paying duties.

In case shareholders' members holding securities in demat mode have any technical issues related to login through Depository or NSDL/CDL, they may contact the respective helpdesk given below:

Login type	Helpdesk details
Individual Shareholders holding securities in demat mode with NSDL	Members facing any technical issue in login can contact NSDL helpline by sending a request at: evoln@nsdl.co.in or call at toll free no: 1800 102 099 and 1800 22 44 30
Individual Shareholders holding securities in demat mode with CDL	Members facing any technical issue in login can contact CDSL helpline by sending a request at: helpline@cdl.com or contact at 022-2305738 or 22-2305842-43

In case shareholders' members holding securities in physical mode, institutional shareholders have any queries pertaining to e-voting, they may refer to the Frequently Asked Questions (FAQs) for Members and e-voting user manual for Members available at the Downloads section of https://investorlink.inmico.co.in or call on toll-free no: 022-49186000.

Book Closure: Pursuant to Section 108 of the Companies Act, 2013 and Rules framed thereunder and Regulation 42 of SEBI (Listing and Disclosure Requirements) Regulations, 2015 the Register of members and the Share Transfer Books of the Company will remain closed from Wednesday, 17th day of January, 2024 to Thursday, 25th day of January, 2024 (both days inclusive) for the purpose of Extra-ordinary General Meeting.

For Rajah Finance Limited
Sd/-
Akash Hirenblal Bheda
Company Secretary & Compliance Officer

Home Secy Allays Fears in Meeting

Our Political Bureau

New Delhi: Union home secretary Ajay Bhalla met some protesting truckers on Tuesday evening to allay their fears against the new law on hit-and-run cases in Bharatiya Nyaya Sahita 2023.

The home ministry official, while citing the section of BNS clarified that Section 106(1) provides for a maximum of 10 years, Section 106 (2) provides for a punishment of imprisonment in hit-and-run cases. The duration of sentences in hit-and-run cases has been increased to 10 years because of the observations made by the Supreme Court.

The Supreme Court has stated that the duration of sentences in hit-and-run cases was increased to 10 years on account of the observations of Ajay Bhalla.

From sub-section (106(1)) and 106(2) of the BNS (Indian Penal Code), it is evident that - If a person immediately reports to a police officer about an accident caused by reckless driving the individual will not be charged under subsection 106(2). Instead, the person will be charged under subsection 106(1), where the sentence is lesser, i.e. up to 10 years.

When the Supreme Court provides for a sentence of up to 10 years, Section 106(1) is still a liable offence, while Section 106(2) has been made non-liable. Instead, the truckers association were of the view that drivers who cause a serious road accident by negligent driving and run away from the scene of accident, an official from the administration can face punishment of up to 10 years or a fine of Rs 7 lakh. The punishment in such cases was 2 years in the Indian Penal Code (IPC).

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PTI

id-in-a-statement

With increased production and maximised supplies through all modes of despatch, the coal output to power plants of the country by the PSU rose to 45 mt during the April-December period, up from 38 mt in the same period of the corresponding period of the previous financial year.

As per the PSU's statement, the increase is 21 mt with around 5% growth," the PSU said.

It produced 532 mt of coal in the April-December period of FY24, logging a year-on-year growth of 11% — PT

